

ત્વરિત જાહેરાત માટે

## જ્યોર્જ હિયકોક શિક્ષણ અનુદાન અને નવા અગ્નિશમન લાસ્કરોની ભરતી માટે બ્રમ્પટન ફાયર, અરજીઓ સ્વીકારી રહ્યા છે

બ્રમ્પટન, ઓન્ટારિયો (01 માર્ચ 2022) – બ્રમ્પટન ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસિસ જ્યોર્જ હિયકોક મેમોરિયલ એન્ડોમેન્ટ ફંડ માટે અરજીઓ સ્વીકારી રહ્યા છે. વાર્ષિક શિક્ષણ અનુદાન (બર્સરી) પ્રોગ્રામ એવા વ્યક્તિઓને ઓફર કરવામાં આવે છે જેમને અગ્નિશમન સેવાઓમાં કારકિર્દી બનાવવામાં રસ હોય.

અરજી કરવા લાયક ઠરવા માટે રસ ધરાવતા ઉમેદવારો આ મુજબ હોવા જોઈએ:

- બ્રમ્પટનના રહેવાસીઓ હોવા જોઈએ, કેનેડાના નાગરિક હોય, અને કેનેડામાં કામ કરવાની લાયકાત ધરાવતા હોય
- અગ્નિશમન સંબંધિત ઓન્ટારિયો પોસ્ટ-સેકન્ડરી સ્કૂલ ડિપ્લોમાનો અભ્યાસ કરતા હોય
- અરજીનું ફોર્મ પૂર્ણ કરીને એપ્રિલ 15 સુધીમાં રજૂ કરવું.

[bramptonfire.com](http://bramptonfire.com) પર અરજીઓ ઉપલબ્ધ છે અને તે [firelife@brampton.ca](mailto:firelife@brampton.ca) પર રજૂ કરી શકાશે. અરજીઓ એપ્રિલ 15 સુધી અથવા મહત્તમ 30 જેટલી પ્રાપ્ત થાય ત્યાં સુધી સ્વીકારાશે.

પસંદગીનાં ઉમેદવારોને ઈન્ટરવ્યુમાં ભાગ લેવા આમંત્રિત કરાશે અને એક અરજદારને \$1,000ની રકમના શિક્ષણ અનુદાન માટે પસંદ કરાશે જેની ચૂકવણી સીધી કોર્સની ભરતી માટે કરાશે. સફળ થયેલા અરજદારે ઓન્ટારિયો પોસ્ટ-સેકન્ડરી સ્કૂલ પ્રોગ્રામનું પ્રૂફ ઓફ એક્સેપ્ટન્સ (સ્વીકૃતિનો પુરાવો) પૂરો પાડવાનો રહેશે.

જ્યોર્જ હિયકોક મેમોરિયલ એન્ડોમેન્ટ ફંડની સ્થાપના 2014માં દિવંગત ડિવિઝન ચીફ જ્યોર્જ હિયકોકના સન્માનમાં કરવામાં આવી હતી જેમણે બ્રમ્પટન ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસિસની ટીમમાં 33 વર્ષો સુધી સેવા આપી હતી. ફાયર/લાઈફ સેફ્ટી એડ્યુકેશન ડિવિઝનની સ્થાપનામાં તેઓ મધ્યવર્તી હતાં જેઓ દર વર્ષે હજારો બ્રમ્પટનવાસીઓને આગ સામે સુરક્ષા વિષયક કેળવણી આપવાનું સાધન બન્યું છે.

વધુ માહિતી માટે અને અરજી કરવા માટે, અહીં મુલાકાત લો [bramptonfire.com](http://bramptonfire.com)

**ભરતી**

બ્રેમ્પટન ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસિસ લાલમાં નવા અગ્નિશમન વાસ્કરોની ભરતી કરી રહ્યા છે. અરજીઓ માર્ચ 21 સુધી સ્વીકારાશે. જે અરજદારોને અગ્નિશમન સેવાઓમાં કારકિર્દી બનાવવામાં રસ હોય તેઓને માર્ચ 9ના રોજ સાંજે 6 વાગ્યે હાથ ધરાશે તે વર્ચુઅલ કરિઅર ઈન્ફોર્મેશન સેશનમાં ભાગ લેવા આમંત્રણ છે. હાજરી આપવા માટે અહીં રજિસ્ટર થાઓ [bramptonfire.com](http://bramptonfire.com)

બ્રેમ્પટન ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસિસમાં કારકિર્દી બનાવવા માટેની વધુ માહિતી માટે અહીં મુલાકાત લો [bramptonfire.com](http://bramptonfire.com)

**સુવાક્યો**

"આપણી બ્રેમ્પટન ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસિસ ટીમમાં એવા વ્યક્તિઓનો સમાયેલા છે જેઓ સમુદાય અને અગ્નિ સલામતી માટે પ્રતિબદ્ધ છે. જ્યોર્જ હિચકોક ટીમના પ્રેરણાદાયક સભ્ય હતા અને હું લાયકાત ધરાવતા બ્રેમ્પટનવાસીઓને આ તક માટે અરજી કરવા પ્રોત્સાહિત કરું છું જેઓ અગ્નિશમન સેવાઓમાં કારકિર્દી બનાવી રહ્યા છે."

- પેટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

"બ્રેમ્પટન ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસિસની ટીમ રોજ જ આપણો સમુદાય સલામત રહે તે માટે આકાશ પાતાળ એક કરે છે અને બ્રેમ્પટન એક સ્વાસ્થ્યપ્રદ અને સલામત શહેર બને તેમાં યોગદાન આપે છે. તેઓ એવી ટીમ બનાવવા માટે પણ પ્રતિબદ્ધ છે જે એટલી વૈવિધ્યસભર, સર્વસમાવેશક હોય જે તેઓ સેવા આપે છે તે સમુદાયના દર્શન કરાવે. વાર્ષિક શિક્ષણ અનુદાન (બર્સરી) પ્રોગ્રામ ફરી થઈ રહ્યો છે તે જાણી આનંદ થાય છે જે અમારા અગ્નિશમનના ભાવિ વાસ્કરને સહાય મેળવવાની તક આપશે.

- રોવેના સાન્તોસ, રીજનલ કાઉન્સિલર, વોર્ડ 1 અને 5; પ્રમુખ, કમ્યુનિટી સર્વિસિસ, સિટી ઓફ બ્રેમ્પટનના પ્રમુખ

"ડિવિઝન ચીફ જ્યોર્જ હિચકોક અગ્નિશામક સેવાઓ અને સમુદાય સુરક્ષાના પ્રખર ચેમ્પિયન હતા. તેમણે બ્રેમ્પટન ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસિસને જે યોગદાન આપ્યું છે તેના વારસા તરીકે આ શિક્ષણ અનુદાન આપતા અને કોઈ મહત્વાકાંક્ષી અગ્નિશામક વાસ્કરને સહાય મેળવવામાં મદદ કરતા સન્માનની લાગણી થાય છે.

- બિલ બોચ, ચીફ, બ્રેમ્પટન ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસિસ

બ્રેમ્પટન ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસિસ સમાજમાં સુરક્ષા આપવા અને શિક્ષણ આપવા અથાક કામ કરે છે. હું અગ્નિશમન સેવાઓમાં કારકિર્દી બનાવવામાં રસ ધરાવતા રહેવાસીઓને એક અતુલ્ય ટીમનો ભાગ બનવા અને સમુદાયને પાછા આપવાની આ આકર્ષક તક માટે અરજી કરવા પ્રોત્સાહિત કરું છું.”

- પૉલ મોરિસન (Paul Morrison), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સિટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે [www.brampton.ca](http://www.brampton.ca)

**મિડિયા સંપર્ક (MEDIA CONTACT):**

સિટી ઓફ બ્રેમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

[multiculturalmedia@brampton.ca](mailto:multiculturalmedia@brampton.ca)